



શિક્ષક - એ. આઇ પીરજાદા
ભૂજપુર પ્રાથમિક શાળા-૧ મુંદરા કચ્છ



ડ - ડમળ, ડબૂતર **ડા** - ડાતર, ડાબર **ડિ** - ડિંગારો, ડિવી **ડી** - ડીડી, ડીટલી
ડુ - ડુહાડી, ડુદરતી દ. **ડૂ** - ડૂતરું, ડૂડર **ડે** - ડેરી, ડેબ **ડે** - ડેલાણ પર્વત
ડાં - ડાંયલ, ડોટ **ડાં** - ડાંતૂદલ **ડાં** - ડાંદોઈ, ડાંડોત્રી **ડ :** - ડ :



ખ- ખટારો, ખલ
 ખી- ખીલી, ખીર
 ખે- ખંડૂત, ખંતર
 ખૌ- ખૌં

ખા- ખાટલો, ખાતાબુક
 ખુ- ખુશ, ખુશી
 ખૈ- ખૈં, ખૈંડ્યું
 ખં- ખંજરી, ખંભાતી તાળું


ખિ- ખિસકોલી, ખિલખિલાટ
 ખૂ- ખૂણો, ખૂણી
 ખો- ખોલો, ખોદકામ
 ખઃ ખઃ



GA - गंगाधर, गधेडुं
GA - गीध, गीलीएडा
GA - गेट, गेडीएडा
GA - गौशाळा, गौसाता


GA - गाडुं, गाखर
GA - गुजरात, गुलाब
GA - गौ
GA - गंगा, गंगाधर

GA - गीटार, गिरनार
GA - गूडीया, गूय
GA - गौलाकार, गौली
GA - गः



ઘ- ઘર, ઘડિયાળ	ઘા- ઘાસ, ધારી	ઘિ- ઘિસોડું, ઘિલેરી
ઘી- ઘી, ઘી-કેળાં	ઘુ- ઘુમ્મટ, ઘુઘાટ	ઘૂ- ઘૂઘરી, ઘૂડખર
ઘે- ઘેતું, ઘેરતો	ઘૈ- ઘૈયું	ઘો- ઘોડો, ઘોડિયું
ઘૌ- ઘૌ	ઘં- ઘંટકી, ઘંટી	ઘઃ ઘઃ

શિક્ષક - એ. આઇ પીરજાદા
ભૂજપુર પ્રાથમિક શાળા-૧ મુંદરા કચ્છ



ચ- ચકલી, ચમચી	ચા-ચા, ચાકડો	ચિ-ચિત્ર, ચિટ્ટી
ચી-ચીકુ, ચોપિયાં	ચુ-ચુમોતેર, ચુપ	ચૂ-ચૂનાં, ચૂલો
ચે-ચેરી, ચેસ	ચૈ-ચૈત્ર, ચૈત્ય	ચૌ-ચૌલેટ, ચૌક
ચૌ-ચૌદ, ચૌહાણ	ચં-ચંદ્ર, ચંપલ	ચઃ ચઃ



જ - જમરાખ, જગા

ઞ - જાડાં, ઘણાં

જિ - જિરાઈ, જિલ્લો

જી - જીરું, જીભ

જુ - જુવાર, જુલાઈ

જૂ - જૂદાં, જૂથ

જે - જેટલોમાન, જેલ

જૈ - જૈન, જૈમિન

જો - જાંડર, જાંબુ

જા - જાંદરી, જાંદર

જં - જંગલ, જંકશાન

જઃ જઃ



ક - કલલું, કરણું

કી - કીપ, કીટોવી

કે - કેરીદવા, કેરીસાપ

કો - કો

કા - કાસ, કાલર

કુ - કુમખો, કુમ્મર

કૈ - કૈલ, કૈર


કં - કંડો, કંકેડ્યું

કિ - કિબા, કિબાફોસિંગ


કૂ - કૂલો, કૂ

કો - કોલી, કોણું

કઃ કઃ



- | | | |
|---------------------------|---------------------|------------------------|
| ટ - ટપાલી, ટમેટું | ટા - ટાઇમટેબલ, ટાઇ | ટિ - ટિકિત, ટિકિટ |
| ટી - ટીટોડી, ટીવી | ટુ - ટુપેલ, ટુકડાં | ટૂ - ટૂથબ્રશ, ટૂથપેસ્ટ |
| ટે - ટેબલલેમ્પ, ટેનિસ બોલ | ટૅ - બટ્ટર | ટો - ટોપી, ટોચ |
| ટૌ - ડટાલી, ટાઇટર | ટં - ટંબલર, ટંગસ્ટન | ટઃ ટઃ |




- | | | |
|----------------------|-------------------------|-------------------|
| ક - કગ , કળિયાં | કા - કામ , કાગાંઘ્યા | કિ - કિપ , કિંગુણ |
| કી - કીકરું , કીબું | કુ - કુંડું , કુલવાવવું | કૂ - કૂમડો બુકું |
| કે - કેકડો , કેકાણું | કૈ - કૈયા | કૌ - કૌર , કૌહો |
| કૌ - કૌતી | કં - કંડો , કંડું | કઃ કઃ |




ड - डगलौ, डमरुं डल - डाल, डधियां डिल - डिकलन, डिश
 डी - डीकल, डिलीट डी डु - डुगडुगियुं, डुंगर डू - डूया, डूंगली
 डे - डेकर, डेरीडारम ड - डे डे - डेड, डेडर
 डौ - डौ डं - डंकी, डंगारो डः - डः



ણ - આણ, ફેણ	ણા - હરણા, બારણા	ણિ - મણિ, ગણિત
ણી - લપસણી, બરણી	ણુ - ઝરણુ, ચોરાણુ	ણ્ - કુલુ ધામ, લાખણુ
ણે - આણેક, તરણેતર	ણેં - ણેં	ણો - તોરણો, અરણો
ણોં - ણોં	ણાં - બારણાં	ણાઃ - ણાઃ




ત - તલધાર, તપેલી	તા - તાડ, તાજમહેલ	તિ - તિથેરો, તિરાડ
તી - તીર, તીનોઘોડો	તુ - તુલસી, તુલા	તૂ - તૂંધેરદાળ, તૂર
તે - તેષ, તેલિબીયાં	તૈ - તૈલચિત્ર, તૈયાર	તો - તોચગુ, તોપ
તૌ - તૌહિન	તં - તંબુ, તંબૂરો	તઃ - તઃ



થ - થડ, થરમોસ
 થી - હાથી, ડાથી
 થે - થંપલા, થેલી
 થૈ - થૈ

થા - થાળી, થાળી
 થુ - થુલી, ભાથુ
 થૈ - થૈ
 થં - થંભવુ, થંભાવવુ

થિ - થિચેટર, થિંગાંડું
 થૂ - થૂ
 થો - થોર, થોકડી
 થઃ થઃ



ઘ - ઘજા, ઘનૂષ

ઘા - ઘાબળાં, ઘાબુ

ઘિ - ઘિરાણ, ઘિકકાર

ઘી - ઘીમું, ઘીરજ

ઘુ - ઘુમાડા, ઘૂબેલી

ઘૂ - ઘૂપસળી, ઘૂમ્પાન મનાઈ


ઘે - ઘેર્ય, ઘેનુ

ઘે - ઘેર્યાવાન, ઘેર્ય

ઘો - ઘોરણ, ઘોળી

ઘા - ઘા

ઘં - ઘંધાર્ય, ઘંધાકીય ઘઃ - ઘઃ



ન - નગારું, નકલો

ની - નીમરણી, નીલોરંગ

ને - નેમપ્લેટ, નેત્ર

નો - નૌકા, નૌકાવિહાર

ના - નાક, નાગરવેલ

નુ - ધનુષ, નુસખો

ને - નૈયા, નૈવેદ્ય, નૈમગિક

નં - નંદકિશોર, નંબર


નિ - નિશાળ, શનિવાર

નૂ - નૂલનવર્ષ, નૂડલ્સ

નો - નોખિયા, નૌકા


નઃ - નઃ

શ્રી કલ્પ




પ - પતંગ, પપૈયું
 પી - પીલું, પીંછું
 પે - પેઇન્ટીંગ, પેંસ
 પૌ - પૌંચ, પૌંઆ


પા - પાન, પાકીટ પિ - પિચકારી, પિલ્લા
 પુ - પુરુષપગુણ, પુરાણ પૂ - પૂનમ, પૂરીશાક
 પૈ - પૈસા, પૈંડું પો - પોપટ, પોટલું
 પં - પંખી, પંખા પ: પ:



ल - लसरडा, लसरडा ला - लागाकार, लाहुरि लि - लिखारी, लिप्रा
 ली - लीत, छोटा लीम लु - लुललुलामागी लू - लूणोण, लूंघुप
 ले - लोट, लेंश लै - लैरघ, लैया लो - लोखन, लोखन
 लौ - लौअतिड, लौविड लं - लंडार, लंडार लः लः




म- मरच्युं, मगर मा, माटलुं, माईलस्टोन, मि- मिआईल, मिक्शर
 मी- मीगुअली, मीहु मु- मुकुट, मुष्पत्र मू- मूछ, मूर्ति
 मै- मैधधनुष्य, मैथी मँ- मँया, मँजुरा मा- मौय्ये, मौजडी
 मौ- मौलिङ, मौन मं- मंगल, मंजुरा मः मः



- | | | |
|-------------------|----------------------------|------------------|
| य - यति, यज्ञ | या - याक, वधयात्रा | यि - यिर्तेजियम |
| यी - यीस्ट (झुगा) | यु - युग्मकोल, युनिवर्सिटी | यू - युरिया, यूथ |
| ये - येनडेन, येन | यै - यै | यौ - योग |
| यौ - यौधेय, यौवन | यं - यंत्रिक, यंत्र | यः - यः |

શિક્ષક - એ. આઇ પીરજાદા
ભૂજપુર પ્રાથમિક શાળા-૧ મુંદરા કચ્છ



૨- રમકડું, રતાળું	૨૧- રાખડી, રાચરાચીલું	૨૨- રિમ્મા, રોમોટ
૨૩- રોંછ, રોંગાણા	૨૩- રુઆખ, તરુ	૨૩- રુમાલ, રૂપિયો
૨૪- રેલગાડી, રેતી	૨૪- રૈપતક	૨૪- રોટલી, રોડ
૨૫- રોંધ, રોંધ્ય	૨૫- રંગ, રંગબેરંગી	૨૬- રૂ:



ल - लकडखोए, लसगु ला - लाखुंडु, लडिस्पीकर लि - लिपी, लिटर

ले - लेखन, लेखजोशु लै - लै लो - लोकेशन लो गो

लौ - लौडिक लं - लंघगोण, लंघ लः लः

ली - लीमडो, लीणु लु - लुहार, लुम लू - लुमआ



ଶ - ସାର୍ଗାଠ, ଶରଭନ
 ଶୀ - ଶୀର୍ଷାଭନ, ଶୀଂଗ
 ଶୋ - ଶୋତରଞ୍ଚ, ଶୋରଡ଼ି
 ଶା - ଶାଂଥୀଗୀତ

ଶା - ଶାଠ୍ଟାଗ, ଶାଠ୍ଟି
 ଶୁ - ଶୁକ୍ରପାଟ୍ଟ, ଶୁଭଭବାର
 ଶୁ - ଶୁନ୍ୟ, ଶୁର୍ପ
 ଶୋ - ଶୋଳନା, ଶୋଡ଼ାଠାଠ
 ଶା - ଶାଂଥ, ଶାଠ୍ଟି

ଶି - ଶିଖର, ଶିକ୍ଷକ
 ଶା - ଶାଂଥୀଗୀତ
 ଶା: ଶା:



पट्टा
पट्टा

मिषा


सुभाषित

परे

परे

परे

परे
परे
परे
परे
परे



સ - સસલુ, સગડી સા - સાઈકલ, સાઉન્ડ સિ - સિંહ, સિકકા
 સી - સીતાફળ, સીમકાર્ડ સુ - સુગરી, સુડતાળીસ સૂ - સૂર્ય, સૂટકેસ
 સે - સેક્ટીપીઝ, સેલોટપ સૌ - સૌખ્ય, સૈકા સો - સો, સોફા
 સૌ - સૌદર્ય, સૌરજી સં - સંખ્યા, સંગીત સઃ સ

શિક્ષક - એ. આઇ પીરજાદા
ભૂજપુર પ્રાથમિક શાળા-૧ મુંદરા કરછ



હ - હાંસ, હાજી

હા - હાર, હાજરીપત્રક હિ - હિમશીલા હો - હોજાચંત્ર

હી - હીર, હીરા

હુ - હુકકો

હૂ - હૂક

હે - હેલિકોપ્ટર, હેલો

હે - હેયું

હો - હોજાચંત્ર, હોંસી

હો - હો

હોં - હોંસ

હોં - હોંસ



મહાભારત સમાચાર

Email: mahabharatnews9@gmail.com, nitin.soni.1000@facebook.com whatsapp no. 9930056911 સાપ્તાહિક

સંવત ૨૦૨૬ શુક્રવાર સુદ: ૦૮ વર્ષ: ૧૦ અંક: ૨૯ સળંગ અંક: ૪૯૭ પાનાં: ૩ મૂલ્ય: ૫.૦૦ તા. ૦૩-૦૩-૨૦૨૦ થી ૦૯-૦૩-૨૦૨૦ તંત્રી: નીતિન વલ્લભદાસ સોની | સહતંત્રી: કુ. જ્યોતિ એન. સોની

માતૃભાષા બચાવવાનો સંકલ્પ

આપણા ભારત દેશમાં ૫૦૦ થી વધુ ભાષાઓ બોલાય છે, જેમાં સત્તાવાર રીતે '૨૨' ભાષાઓ લેખન માટે માન્ય છે. આપણી ગુજરાતી ભાષા જેમાંની એક છે.

આજના જેટ યુગમાં વિશ્વના સંપર્કમાં રહેવું પડે એટલે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે, માટે અંગ્રેજી શિખવું એ પણ ખોટું નથી.

આજે આપણને વોટ્સએપમાં આવતા મેસેજો ગુજરાતી ભાષામાં લખેલા મેસેજ વાંચવા ખૂબ જ ગમે છે. જો આપણા ઈંગ્લિશ માધ્યમમાં ભણતા બાળકો ગુજરાતી ભાષાનું વાંચન અને લેખન કરી શકે તો એ તેમને અનેક રીતે ખૂબજ ઉપયોગી થશે. કારણ કે ગુજરાતી ભાષાના શબ્દોમાં ખૂબજ મિઠાશ છે. અનેક વિવિધતાઓ છે, જે અન્ય ભાષાઓમાં આપણે અનુભવી શકતા નથી. કારણ કે આપણી મુળત્વ માતૃભાષા ગુજરાતી છે!



પણ ફક્ત માતૃભાષા બચાવો...! બચાવો...!! બચાવો...!!! ના નારાથી આજના અંગ્રેજીમાં ભણતા બાળકો ગુજરાતી શિખવા માટે તૈયાર નહીં થાય, તેના માટે આપણે નક્કર આયોજન કરવું પડશે.

મારા સૂચન છે કે દર રવિવારે જૈન ઉપાશ્રયો, સોસાયટીઓ કે અન્ય ઉપલબ્ધ જગ્યાઓએ ગુજરાતી ભાષાના કક્કો-બારાખડી શીખવવાનું આયોજન કરવું જોઈએ. કક્કો-બારાખડીનું જ્ઞાન હશે તો ગુજરાતી ભાષા સહેલાઈથી વાંચી-લખી શકશે. આ માટે જે બાળક શિખી જાય તેમને આકર્ષક ઈનામ આપવા જોઈએ. આમ થશે તો બાળકોને ગુજરાતી લખતાં - વાંચતા આવડી જશે. આથી ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ વધશે અને પત્રિકા, કંકોતરી, વર્તમાન પત્ર વગેરે તેઓ સરળતાથી વાંચી શકશે.

એક સત્યઘટના લખું છું... મારા માતૃશ્રી અભણ છે. તેમને વાંચતા-લખતાં આવડતું જ ન હતું, પણ જ્યારથી વાગડ સમાજની ખબર પત્રિકા શરૂ થઈ ત્યારથી તેમાં આવતી આપણા સમાજને લગતી જાહેર ખબરો વાંચવાની પ્રબળ ઈચ્છા થતાં તેમણે કક્કો-બારાખડી શિખ્યા, આગળ જતાં આજે તેઓ પોતાની મેળે પત્રિકા વાંચી લે છે. એવી જ રીતે કંકોતરી-છાપા વગેરે પણ સરળતાથી વાંચી શકે છે. કોઈની ગરજ પડતી નથી.

ફક્ત ગુજરાતી ભાષા શિખી લેવાથી ભાષાનું ગૌરવ વધશે નહીં, પણ ગુજરાતી ભાષાના સારા સંસ્કાર દાયક પુસ્તકોનું પ્રભાવના કે અન્ય રૂપે વિતરણ કરશું તો જ ઘરે ઘરે ગુજરાતી ભાષા વંચાશે જીવંત રહેશે.

જ્ઞાનના ફેલાવા માટે દરેક સમાજના દાનવીરો જે અન્ય ક્ષેત્રે દાન કરતા હોય છે. તેમણે ૧૦ ટકા રકમ સારા પુસ્તકોની પ્રભાવના માટે પણ ફાળવવી જોઈએ તો જ દાનનું સાચા

અર્થમાં પુણ્ય મળશે.

સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ગુજરાતી ભાષા બચાવવાના મારા વિચારો પર મંથન કરી અમલમાં મૂકવામાં આવશે તો હું મારા તરફથી સાથ-સહકાર દેવા માટે વચન બદ્ધ છું.

ભાષામાં શુદ્ધિકરણ પણ બહુજ જરૂરી છે. વ્યાકરણ પણ અગત્યનું છે. એ માટે પ્રત્યેક પરિવારે પોતાના ઘરમાં એક શબ્દકોષ પુસ્તક વસાવવું જોઈએ એવું મારું સૂચન છે.

લેખક, પ્રચારક: શ્રી વિપુલ ચાંપશી છેડા

(ગામ: ભયાઉ, હાલ: દહિસર)

પ્રેમધર્મ પુસ્તકના સંકલક: લેખક

દેવની દીધેલ દીકરી પુસ્તકના સંકલક: લેખક

આગામી પુસ્તક: ગુજરાતી પ્રેમધર્મ શબ્દકોષ

મો.નં: 9987872605.

©
પ્રેમધર્મ